

કર્મચારીઓની “CCC-COURSE” પરીક્ષાલક્ષી સુચનાઓ

1. થીયરી પરીક્ષામાં પ્રશ્નપત્ર અંગ્રેજી તથા ગુજરાતી બંને ભાષામાં હશે. અંગ્રેજી પ્રશ્નપત્ર આધારભૂત માનવામાં આવશે.
2. થીયરી પરીક્ષાનો સમય ૧ કલાક તથા પ્રેક્ટીકલ પરીક્ષાનો સમય ૧ કલાક અને ૩૦ મિનિટનો રહેશે.
3. થીયરી અને પ્રેક્ટીકલ પરીક્ષામાં પાસ થવા ૫૦% માર્ક્સ જરૂરી છે. થીયરી તથા પ્રેક્ટીકલ પરીક્ષામાં નેગેટીવ ગુણની પદ્ધતિ નથી. પરિણામની રી-એસેસમેન્ટ કે રી-ચેકિંગની કોઈ વ્યવસ્થા કે જોગવાઈ નથી. જે ધ્યાને લેશો.
4. પરીક્ષા વખતે ઉમેદવારે તેની હોલટિકિટ તથા અસલ ઓળખપત્ર ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/પાસપોર્ટ તથા આધારકાર્ડમાંથી કોઈપણ એક જોડે રાખવું ફરજિયાત છે.
5. સમગ્ર પરીક્ષા દરમ્યાન પરીક્ષાકેન્દ્ર સતત સી.સી.ટી.વી. કેમેરાની નજર હેઠળ રહેશે.
6. પરીક્ષા હોલમાં મોડેથી પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉમેદવારે પરીક્ષાકેન્દ્ર પર પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ વહેલા હાજર રહેવાનું રહેશે.
7. જે ઉમેદવાર પરીક્ષા સમયે હાજર નહીં રહે તેને ગેરહાજર ગણવામાં આવશે. તેવા ઉમેદવારે પરીક્ષા માટે ફરીથી નોંધણી કરાવવાની રહેશે.
8. ઉમેદવારે પોતાના સ્વખર્ચે પરીક્ષા આપવા આવવાનું રહેશે.
9. ઉમેદવારે નોંધાયેલ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર જ પરીક્ષાલક્ષી દરેક સુચના આપવામાં આવશે. જે ધ્યાને લેશો.
10. બોલપેન, મોબાઇલ/સેલફોન, ટેબલેટ, લેપટોપ, કેલ્ક્યુલેટર, બ્લ્યુટૂથ ડિવાઇસ, સ્માર્ટ ઘડિયાળ તથા અન્ય ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ અથવા અન્ય મટીરિયલ્સ પરીક્ષા ખંડમાં લાવવા દેવામાં આવશે નહીં, તથા આવા ઉમેદવારને પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં. તેમજ પરીક્ષાકેન્દ્ર ઉપર કોઈ વસ્તુ મુકવાની સુવિધા રાખેલ નથી. જે ધ્યાને લેશો.
11. સમગ્ર પરીક્ષા દરમ્યાન પરીક્ષા અન્વયેની કોઈપણ પ્રકારની ગેરરીતિ કરતાં માલૂમ પડશે તો તે ઉમેદવારને યુનિવર્સિટી ધારે તેટલા વર્ષ સુધી પરીક્ષામાંથી બાકાત રાખી શકશે.

12. ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીનો નિર્ણય ઉપરની દરેક બાબતોમાં આખરી અને દરેક ઉમેદવારે માન્ય તથા ગ્રાહ્ય રાખવાનો રહેશે.
13. યુનિવર્સિટી દ્વારા કોઈ વધારાનું મહેકમ કે અલગ કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોઈ યુનિવર્સિટીની વેબસાઈટ પર મૂકવામાં આવેલી “CCC” પરીક્ષા અંગેની તમામ માહિતી જ પ્રમાણભૂત માની દરેક ઉમેદવારે સૂચનાઓનું પાલન કરવાનું રહેશે.
14. સી.સી.સી. પરીક્ષા કેમ્પસમાં અનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા આનુષંગિક કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક કરવી નહીં.
15. પરીક્ષાર્થી દ્વારા કે અન્ય કોઈ દ્વારા પરીક્ષા કેમ્પસનો AUDIO/VIDEO CLIP ઉતારી શકાશે નહિ. અનઅધિકૃત ક્રિયા કરનાર સામે શિક્ષાત્મક કે ફોજદારી ગુનો થઈ શકશે. વધુમાં અનઅધિકૃત કામ કરનારની જાણ જે તે વિભાગ/ખાતા ને તથા રાજ્ય સરકારશ્રીને જરૂરી કાર્યવાહી માટે જણાવવામાં આવશે અને યુનિવર્સિટીના નિયમોનુસાર તે પરીક્ષાર્થીનું પરિણામ રદ કરી યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
16. રજીસ્ટ્રેશનથી પરીક્ષાના પરિણામ જાહેર થયા બાદ પણ પરીક્ષાર્થી તરફથી ફોર્મ / ડોક્યુમેન્ટ / પેમેન્ટ રીલેટેડ કોઈપણ પ્રકારની છુપાવવામાં આવેલ વિસંગત બાબત યુનિવર્સિટીના ધ્યાન ઉપર આવશે તો ત્યારે તેનું પરિણામ રદ કરવાનો અધિકાર યુનિવર્સિટીનો રહેશે. પરીક્ષા આનુષંગિક કોઈપણ બાબતમાં વિસંગતતા જણાશે તો રજીસ્ટ્રારશ્રીનો નિર્ણય આખરી ગણાશે અને માન્ય રાખવાનો રહેશે.

વધુમાં તમામનું ન્યાયક્ષેત્રનું સ્થળ ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર રહેશે.

પરીક્ષાર્થી બહેનો માટેની ખાસ સૂચના

પરીક્ષાર્થી બહેનોએ પરીક્ષા આપવા માટે ફોર્મમાં ભરેલ નામનું જ એટલે કે ફોર્મમાં પતિનું નામ હોય તો પતિના નામનું અને પિતાનું નામ હોય તો પિતાના નામનું અસલ ઓળખપત્ર લઈને આવવું.

ઓળખપત્રમાં પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ / આધારકાર્ડ / બેન્કની ફોટોવાળી સહી-સિક્કા સાથેની પાસબુક / સંસ્થાનું આઈકાર્ડ / સંસ્થાના લેટરપેડ ઉપર ફોટો તથા સંસ્થાના સહી-સિક્કા સાથેનું ઓળખપત્ર માન્ય રહેશે.